

પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આદિવાસી સંશોધન -વ- તાલીમ કેન્દ્ર, દેવગઢ બારીયા ખાતે  
આયોજીત બે દિવસીય બે તાલીમ કાર્યક્રમ

પશુ વિજ્ઞાન કેન્દ્ર (લીમખેડા) દ્વારા આદિવાસી સંશોધન -વ- તાલીમ કેન્દ્ર, દેવગઢ બારીયા ખાતે તા. ૨૦-૨૧ સપ્ટે. ૨૦૧૬ “દરમ્યાન પશુપાલનમાં બિનખર્ચાળ તકનીકી પદ્ધતીઓ” અને તા. ૨૨-૨૩ સપ્ટે. ૨૦૧૬ દરમ્યાન “પશુ પોષણ” વિષય પર બે બે દિવસની બે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા. સદર કાર્યક્રમોમાં દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી અને મોટીખજુરી ગામોમાંથી કુલ ૬૩ પશુપાલક બહેનો હાજર રહેલ હતી.

તાલીમ કાર્યક્રમોના પ્રથમ દિવસે ડો. એસ. જી. વહોરા સહ પ્રાધ્યાપક, પશુ વિજ્ઞાન કેન્દ્ર અને યુનિટ અધિકારીશ્રીએ (ઇ.યા) દ્વારા આદિવાસી સંશોધન -વ- તાલીમ કેન્દ્ર, દેવગઢ બારીયાએ આમંત્રિત પશુપાલક મહિલાઓનું શાબ્દિક સ્વાગત તથા સ્વાગત પ્રવચન કર્યું હતું અને અવાર નવાર આવા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવાનું સુચન કર્યું હતું. આ ઉપરાંત આધુનિક સમયની જરૂરીયાત અને મોંઘવારીમાં પશુપાલનની બિનખર્ચાળ તકનીકીઓને અમલમાં લાવી ઓછા ખર્ચે વધુ સારું ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેમજ સંપૂર્ણ પશુઆહાર બનાવવાની પ્રક્રિયા, પશુઓમાં ખોરાકની અગત્યતા અને જે તે વિસ્તારમાં મળતા ખાણદાણનો ઉપયોગ કરી સસ્તો પશુ આહાર બનાવી દુધ ઉત્પાદનનો ખર્ચ ઘટાડો કરી શકાય તેની સમજ આપી.

અત્રેની કચેરીના અધિકારી ડો. જી. એન. થોરાત (મદદનીશ પ્રાધ્યાપક, પશુ વિજ્ઞાન કેન્દ્ર)એ પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓથી હાજર રહેલ પશુપાલકોને માહિતગાર કર્યાં. પશુપાલનમાં મહિલાઓનું રહેલ યોગદાનનું મહત્વ સમજાવ્યું તેમજ સમતોલ આહાર કેવો હોવો જોઈએ, સમતોલ આહાર પશુઓને ન મળવાથી થતી મુશ્કેલીઓ અને તેના નિવારણ વિષયની પશુપાલકોને માહિતી આપી. દિપ્તી પી પટેલ (રીસર્ચ એસોસીએટ) દ્વારા બહેનો માટે પોષણની અગત્યતાની વિસ્તૃત માહિતી આપી. શ્રી ડી. બી. રામજીયાણી (રીસર્ચ એસોસીએટ) એ ઘાસચારાનું વૈજ્ઞાનિક પદ્ધતીથી વધુ અને ગુણવત્તાસભર ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેની સમજણ આપી.

તાલીમ કાર્યક્રમના બીજા દિવસે શ્રી જે. એમ. પટેલ (પશુધન નિરીક્ષક, પશુ વિજ્ઞાન કેન્દ્ર)એ પશુપાલક બહેનોને પંચમહાલ ડેરી અને પંચામૃત દાણ ફેક્ટરી, ગોધરા, અંબિકા મહિલા દુધ સહકારી મંડળી, નદીસર તેમજ પ્રગતીશીલ પશુપાલકના ડેરી ફાર્મની મુલાકાત કરાવેલ હતી.

તા.૨૦-૨૧/૦૯/૨૦૧૬



ડૉ. એસ.જી.વહોરાનું ઉદ્બોધન



ડૉ. જી.એન.થોરાતનું ઉદ્બોધન



શ્રી ડી.બી.રામજીયાણીનું ઉદ્બોધન



ડી.પી.પટેલનું ઉદ્બોધન



ફિલ્ડ વિઝીટ

તા.૨૨-૨૩/૦૯/૨૦૧૬



ડૉ. એસ.જી.વહોરાનું ઉદ્બોધન



ડૉ. જી.એન.થોરાતનું ઉદ્બોધન



શ્રી ડી.બી.રામજીયાણીનું ઉદ્બોધન



ડી.પી.પટેલનું ઉદ્બોધન



ફિલ્ડ વિઝીટ